



I B Patel English School (Primary)

2020-2021

WORKSHEET

Subject – GUJARATI

Class – 4

1. તમે શું ખાશો?

Q1. નીચે આપેલો ફકરો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો.:

એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે. મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે – રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં!

1. નદી કાંઠે શાનું ઝાડ હતું?

2. વાંદરો ઝાડ પર શું ખાવા આવતો?

3. મગર ક્યાં રહેતો હતો?

4. મગર જાંબુ કોની માટે લઈ ગયો?

5. મગરીને જાંબુ કેવા લાગ્યા?

Q 2.(A) નીચેનું ચિત્ર જોઈ ચાર પાંચ વાક્યો લખો:



Q3.(A) નીચેના શબ્દોની જોડણી સુધારો:

બકરિ - _____ બિલલી - _____ સિયાળ - _____

(B) નીચેના શબ્દોના સમાનર્થી શબ્દ લખો:

દોસ્તાર - _____ આનંદ - _____ છાનુંમાનું - _____

(C) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

દૂર - _____ હસવું - _____ પહેલું - _____

(D) નીચે આપેલા શબ્દો પરથી વાક્યો બનાવો:

નાસ્તો - _____

જાદુ - _____

હૂપાહૂપ - _____

Q 4 (A) નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક - એક વાક્યમાં લખો:

1. દોસ્તાર કોણ કોણ બની ગયું?

2. વાંદરાટોળી હૂપાહૂપ ક્યાં કરતી હતી?

3. ચટપટ સુધરી કેમ મોડી પડી?

(B) નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો:

1. "જાદુ કરી ગયો ઝુમરુ". - _____

2. "અમ્મન ચમ્મન, ગુડ કે લહુ". - _____

(C) ખાલી જગ્યા પૂરો:

1. _____ માં તો આનંદ આનંદ થઈ ગયો.
2. બધા _____ પર જમવા ગોઠવાયા.
3. ઝૂમરુ બધી રસોઈ _____ કરી દેશે.



I B Patel English School (Primary)

2020-2021

WORKSHEET ANSWER KEY

Subject – GUJARATI

Class – 4

1. તમે શું ખાશો?

Q1. નીચે આપેલો ફકરો વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો.:

એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે. મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં. મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે – રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં!

1. નદી કાંઠે શાનું ઝાડ હતું?

નદી કાંઠે જાંબુડાનું ઝાડ હતું.

2. જાંબુડાના ઝાડ પર જાંબુ ખાવા કોણ આવતો હતો ?

જાંબુડાના ઝાડ પર જાંબુ ખાવા એક વાંદરો આવતો હતો.

3. મગર ક્યાં રહેતો હતો?

મગર નદીના ઊંડા પાણીમાં રહેતો હતો.

4. મગર જાંબુ કોની માટે લઈ ગયો?

મગર જાંબુ મગરી માટે લઈ ગયો.

5. મગરીને જાંબુ કેવા લાગ્યા?

મગરીને જાંબુ મીઠા લાગ્યા.

Q 2.(A) નીચેનું ચિત્ર જોઈ ચાર પાંચ વાક્યો લખો:



આ ચિત્રમાં એક બગીચો છે.

બગીચામાં બે છોકરીઓ રમે છે.

એક છોકરી હીંચકા પર બેઠી છે અને બીજી લપસણી ખાય છે.

ત્યાં એક મોટું ઝાડ અને ઘાને સુંદર ફૂલો પણ છે.

આકાશમાં સુરજદાદા ચમકી રહ્યા છે.

Q3.(A) નીચેના શબ્દોની જોડણી સુધારો:

બકરિ – બકરી

બિલલી – બિલ્લી

સિયાળ- શિયાળ

(B) નીચેના શબ્દોના સમાનર્થી શબ્દ લખો:

દોસ્તાર – મિત્ર

આનંદ – ખુશી

છાનુંમાનું – ચુપચાપ

(C) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો:

દૂર - નજીક

હસવું - રડવું

પહેલું - છેલ્લું

(D) નીચે આપેલા શબ્દો પરથી વાક્યો બનાવો:

જાદુ - મને એક જાદુ આવડે છે.

હૂપાહૂપ - ઝાડ પર વાંદરાઓ હૂપાહૂપ કરે છે.

Q 4 (A) નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક - એક વાક્યમાં લખો:

1. દોસ્તાર કોણ કોણ બની ગયું?

એક કબૂતર અને પતંગિયું દોસ્તાર બની ગયાં.

2. વાંદરાટોળી હૂપાહૂપ ક્યાં કરતી હતી?

વાંદરાટોળી વડલાડાળે હૂપાહૂપ કરતી હતી.

3. ચટપટ સુધરી કેમ મોડી પડી?

ચટપટ સુધરી ખટપટ વાંદરાને શોધવામાં મોડી પડી.

(B) નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો:

1. “જાદુ કરી ગયો ઝૂમરુ”. - ઉંદરે કહ્યું

2. “અમ્મન ચમ્મન, ગુડ કે લહુ”. - ઝૂમરુએ કહ્યું

(C) ખાલી જગ્યા પૂરો:

1. મયૂરપુરીમાં તો આનંદ આનંદ થઈ ગયો.

2. બધા ડાઇનિંગ ટેબલ પર જમવા ગોઠવાયા.

3. ઝૂમરુ બધી રસોઈ છૂમંતર કરી દેશે.